



ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુદિલ્હી (FICCI)ની સંઘર્ષમય કારોબારી સમિતિની ચુંટણીમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની જીત.... સમગ્ર વેપાર-ઉદ્યોગ આલમમાં હર્ષની લાગણી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હર હંમેશ વેપાર-ઉદ્યોગના પ્રશ્નોના યોગ્ય અને સચોટ નિરાકરણ લાવવા માટે અગ્રેસર રહે છે. તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં રજુઆતો કરી ઉદભવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. રાજકોટ ચેમ્બર નેશનલ લેવલની સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુ દિલ્હીમાં સભ્યપદ ધરાવે છે. તાજેતરમાં (FICCI) ન્યુ દિલ્હીની ૮૪ મી વાર્ષિક સામાન્ય સભા તથા કારોબારી સમિતિની ચુંટણી ઓનલાઈન યોજવામાં આવેલ. જેમાં ટ્રેડ અને સર્વિસ ક્લેટેગરીમાં ૬ સીટ માટે ૧૩ ઉમેદવારો નોંધાયેલ હતા. આ સંઘર્ષમય કારોબારી ચુંટણીમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની જીત થયેલ છે. જેની ટર્મ ૩ વર્ષ માટેની રહેશે. FICCI ની કારોબારી સમિતિમાં ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવને સ્થાન મળવાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌરવની બાબત ગણાય.

FICCI એ નેશનલ લેવલની સંસ્થા હોય ભારત દેશના રાજ્યોની તમામ ચેમ્બરોનું ફેડરેશન છે. જેના મંતવ્યો તથા માર્ગદર્શન દેશની આર્થિક નીતી ધડવા માટે ખુબ જ મહત્વના ગણાય છે. તેમજ ઈન્ટરનેશનલ ડેલીવેશન અને કેન્દ્ર સરકાર સાથે આર્થિક વિચાર-વિમર્શ કરવા માટે ભારતનું મુખ્ય સેન્ટર ગણાય છે. તેથી આ સ્થાન પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવને મળવાથી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોના પ્રશ્નોને ખુબ જ મહત્વ સાથે વાચા મળશે. આમ FICCI ની કારોબારી સમિતિમાં સ્થાન મળવાથી રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ ખુબ જ ઉંચી ઉડાન ભરી છે. પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં રીજીઓનલ સેક્રેટરી જેવા મહત્વના પદ પર રહી ચુક્યા છે અને હાલ તેઓ ગુજરાત ચેમ્બરમાં ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. આથી તમામ વેપાર-ઉદ્યોગકારોને તેઓને ઉદભવતા પ્રશ્નો કે સુચનો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા પણ અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.